

August 02, 2025

To,  
**National Stock Exchange of India Limited**  
Symbol – Symphony

To,  
**BSE Limited**  
Security Code – 517385

**Sub.: Submission of newspaper clippings of publication of financial results**

Dear Sir / Madam,

We are submitting herewith newspaper clippings of unaudited financial results for the first quarter ended on June 30, 2025, published on August 02, 2025.


Please take the same on your record and kindly acknowledge the receipt.

Thanking you,

Yours Truly,  
**For, Symphony Limited**

**Mayur Barvadiya**  
**Company Secretary and Head - Legal**

*Encl.: as above*



**WEST COAST PAPER MILLS LIMITED**  
Registered Office: PB No.5, BANGUR NAGAR, DANDELI – 581 325,  
DIST: UTTARA KANNADA, KARNATAKA, CIN: L02101KA1955PLC001936,  
GSTIN: 29AAACT4179N1ZO, Ph: (08284) 231391 – 395 (5 Lines)  
Email: [co.sec@westcoastpaper.com](mailto:co.sec@westcoastpaper.com), Website: [www.westcoastpaper.com](http://www.westcoastpaper.com)

**NOTICE FOR SPECIAL WINDOW**  
SEBI has discontinued transfer of securities in physical mode with effect from April 01, 2019. Subsequently, it was clarified that transfer deeds lodged prior to deadline of April 01, 2019 and rejected/returned due to deficiency in the documents may be re-lodged with requisite documents upto March 31, 2021 as cut-off date.  
In order to facilitate ease of investing for investors and to secure the rights of investors in the securities which were purchased by them, SEBI, pursuant to Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/ CIR/2025/97 dated July 02, 2025, decided to open a special window only for re-lodgement of transfer deeds, which were lodged prior to the deadline of April 01, 2019 and rejected/returned/not attended due to deficiency in the documents/process/or otherwise, for a period of six months from July 07, 2025 till January 06, 2026.  
Therefore eligible Shareholders are requested to re-lodge Share transfer request along with requisite documents to Company's RTA i.e., MUFG Intime India Pvt. Ltd, C 101, 247 Park, L.B.S. Marg, Vikhroli (West), Mumbai, Maharashtra-400083, within stipulated period. Shares re-lodged for transfer shall be processed only in demat mode.  

For **WEST COAST PAPER MILLS LIMITED**  
**Brajmohan Prasad**  
**Company Secretary, M.No.F7492**

Place : Dandeli  
Date : 01.08.2025



**ramco**  
**RAMCO SYSTEMS LIMITED**  
CIN: L72300TN1997PLC037550  
Registered Office: 47, P S K Nagar, Rajapalayam - 626 108  
Corporate Office: 64, Sardar Patel Road, Taramani, Chennai - 600 113  
E-mail : [investorrelations@ramco.com](mailto:investorrelations@ramco.com) Website: [www.ramco.com](http://www.ramco.com)  
Phone: +91 44 2235 4510/6653 4000, Fax: +91 44 2235 2884

**SPECIAL WINDOW FOR RE-LODGEMENT OF TRANSFER REQUESTS OF PHYSICAL SHARES**  
Pursuant to SEBI circular No.SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated 2<sup>nd</sup> July 2025, shareholders are informed that, a special window is opened only for re-lodgement of transfer deeds, lodged prior to 1<sup>st</sup> April 2019, and which were rejected/returned/not attended to, due to deficiency in the documents /process/or otherwise.  
This facility of re-lodgement will be available from 7<sup>th</sup> July 2025 to 6<sup>th</sup> January 2026.  
Shareholders are requested to re-lodge such cases with the RTA, latest by 6<sup>th</sup> January 2026 at the following address:  
**Cameo Corporate Services Limited (Unit: Ramco Systems Limited)**  
[Subramanian Building], No.1, Club House Road,  
Chennai – 600002, Tamil Nadu, India  
Phone: +91 44 4002 0700  
Online Investor Portal : <https://wisdom.cameoindia.com>  
Website : [www.cameoindia.com](http://www.cameoindia.com)  
The lodger must have a demat account and provide its Client Master List ('CML'), along with the transfer documents and share certificate, while lodging the documents for transfer with RTA.  

For **RAMCO SYSTEMS LIMITED**  
Sd/-  
**MITHUN V**  
**COMPANY SECRETARY**

Place: Chennai  
Date: August 01, 2025




**5paisa**

**5PAISA CAPITAL LIMITED**  
CIN: L67190MH2007PLC289249  
Regd. Office: IIFL House, Sun Infotech Park, Road No.16V, Plot No. B-23, MIDC, Thane Industrial Area, Wagale Estate, Thane - 400064. Tel: +91 22 4103 5000 | Fax: +91 22 2580 6654 | Email: [csteam@5paisa.com](mailto:csteam@5paisa.com) | Website: [www.5paisa.com](http://www.5paisa.com)

**NOTICE OF 18<sup>th</sup> ANNUAL GENERAL MEETING AND REMOTE E-VOTING INFORMATION**  
Notice is hereby given that the 18<sup>th</sup> (Eighteenth) Annual General Meeting ("AGM") of the Members of 5paisa Capital Limited ("the Company") is scheduled be held on **Monday, August 25, 2025 at 11:30 AM (IST) through Video Conferencing ("VC") and / or Other Audio-Visual Means ("OAVM")** to transact the businesses as set out in the Notice convening the AGM. The Notice of the AGM and the aforesaid documents are available on the website of the Company i.e. [www.5paisa.com](http://www.5paisa.com), websites of the Stock Exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) respectively.  
The Company has sent the Annual Report for FY 2024-25 along with the Notice of AGM and remote e-voting procedure on Friday, August 01, 2025 through electronic means to those Members whose e-mail addresses are registered with the Company / Depository(ies) / Register and Share Transfer Agent ("RTA") in compliance with the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and the rules framed thereunder read with the General Circulars issued by the Ministry of Corporate Affairs ("MCA") vide General Circular No's. 14/2020 dated April 08, 2020; 17/2020 dated April 13, 2020; 20/2020 dated May 05, 2020; 10/2020 dated December 28, 2022; 09/2023 dated September 25, 2023 and the relevant circulars issued in this regard, the latest being 09/2024 dated September 19, 2024 (collectively referred to as "MCA Circulars") and by the Securities and Exchange Board of India ("SEBI") vide Circular No's. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020; SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021; SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022; SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 05, 2023; SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated October 07, 2023 and the latest being Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2024/133 dated October 03, 2024 (collectively referred to as "SEBI Circulars").  
Further, in accordance with Regulation 36(1) of the Listing Regulations, the Company has dispatched letters to those shareholders whose email addresses are not registered with the Company / Depository Participant(s) / RTA, providing the weblink and Quick Response ("QR") Code to access the Notice along with Annual Report for the FY 2024-25 of the Company.  
**Instructions for remote e-voting and e-voting during the AGM**  
In terms of Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations") and Secretarial Standard - 2 on General Meetings issued by the Institute of Company Secretaries of India (ICSI), the Company is providing the facility to its Members to exercise their right to vote by electronic means ("e-voting") on any or all of the businesses specified in the Notice convening the 18<sup>th</sup> AGM of the Company through e-voting services of Central Depository Services (India) Limited ("CDSL"). The details pursuant to the Act are as under:  
a) Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e., **Monday, August 18, 2025**, are eligible to exercise their right to vote by using the remote e-voting / e-voting system on any or all of the businesses specified in the Notice convening the AGM of the Company.  
b) Pursuant to Section 91 of the Act read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of the SEBI Listing Regulations, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from **Tuesday, August 19, 2025 to Monday, August 25, 2025 (both days inclusive)** for the purpose of ensuing Annual General Meeting.  
c) The remote e-voting will commence on **Wednesday, August 20, 2025 at 09:00 AM (IST)** and will end on **Sunday, August 24, 2025 at 05:00 PM (IST)**.  
d) The remote e-voting module shall be disabled for voting thereafter and once the vote on a resolution is cast by the member, he / she shall not be allowed to change it subsequently or cast the vote again.  
e) The Members can participate in the AGM even after exercising their right to vote through remote e-voting but shall not be eligible to cast their vote again in the AGM.  
f) The members who remain present at the AGM and have not cast their vote through remote e-voting, shall be eligible to vote through e-voting system available during the AGM.  
g) Only a person whose name is recorded in the Register of Members or the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date i.e., **Monday, August 18, 2025**, shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting during the AGM.  
h) Members who are holding shares in physical form or non-individual Members who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date i.e. **Monday, August 18, 2025** may obtain the User ID and Password by following the procedure / instructions prescribed in the Notice of AGM. However, if a person is already registered with the depository for remote e-voting, then they can use their existing User ID and Password for casting their vote.  
i) In case of Individual Member holding securities in demat mode and who acquires shares of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date i.e., **Monday, August 18, 2025** may follow steps mentioned in the Notice of the AGM relating to remote e-voting.  
j) Members are requested to intimate changes, if any pertaining to their name, postal address, email address, telephone / mobile numbers, Permanent Account Number (PAN), mandates, nominations, power of attorney, bank details such as name of the bank and branch details, bank account number, MICR code, IFSC Code etc., as mentioned in the notice of the AGM.  
k) The Board of Directors of the Company has appointed CS Aparna Joshi, proprietress - M/s. Aparna Paricharak & Associates, Practicing Company Secretaries, as the Scrutinizer for the AGM to Scrutinize the e-voting process in a fair and transparent manner.  
In the case of any queries / grievances relating to e-voting, Members may refer to the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at [www.evotingindia.com](http://www.evotingindia.com) under help section or send an email to [helpdesk.evoting@cdslindia.com](mailto:helpdesk.evoting@cdslindia.com) or contact Mr. Deborshi Choudhary – Deputy Manager from CDSL at 022-23058738 and 022-23058542/43 or at toll free no. 1800 21 09911.  

For **5paisa Capital Limited**  
Sd/-  
**Gourav Munjal**  
**Whole-time Director & CFO**  
DIN: 06360031  

Place : Thane  
Date : August 01, 2025



**CENTURY ENKA LIMITED**  
CIN: L24304PN1965PLC139075  
Regd. Office: Plot No.72 & 72A, MIDC, Bhosari, Pune - 411026.  
Tel. No.: 020-66127304 • Fax No.: 020-27120113  
Website: [www.centuryenka.com](http://www.centuryenka.com) • Email: [cel.investor@adityabirla.com](mailto:cel.investor@adityabirla.com)


**STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THREE MONTHS ENDED 30<sup>TH</sup> JUNE, 2025**  
₹ in Lacs  

Sr. No.	Particulars	Three Months Ended		Year Ended	Three Months Ended		Year Ended
		30-Jun-25	31-Mar-25	30-Jun-24	31-Mar-25	30-Jun-25	31-Mar-25
		Standalone		Consolidated			
		Unaudited	Audited	Unaudited	Audited	Unaudited	Audited
1	Total Income from Operations	41,516	45,925	53,540	203,901	41,516	45,925
2	Net Profit before Tax and before Exceptional Items	1,901	944	3,443	9,257	1,904	929
3	Net Profit before Tax and after Exceptional Items	1,901	944	3,443	9,257	1,904	929
4	Net Profit after Tax and after Exceptional Items	1,535	691	2,429	6,710	1,538	676
5	Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after Tax) and Other Comprehensive Income (after Tax)]	1,768	754	3,124	7,565	1,771	739
6	Paid-up Equity Share Capital (Face value of ₹ 10 each)	2,185	2,185	2,185	2,185	2,185	2,185
7	Basic & Diluted Earnings Per Share (of ₹10 each) (Quarterly - Not Annualised)	7.02	3.16	11.12	30.71	7.04	3.09

Notes:  
1) The above results have been reviewed and recommended for approval by the Audit Committee to the Board of Directors and have been approved by the Board of Directors at its meeting held on 1<sup>st</sup> August, 2025  
2) The above is an extract of the detailed format of Quarterly Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Results are available on the Stock Exchange website ([www.nseindia.com](http://www.nseindia.com)) and [www.bseindia.com](http://www.bseindia.com)) and on Company's website ([www.centuryenka.com](http://www.centuryenka.com)).

For and on behalf of Board of Directors  
Sd/-  
**Suresh Sodani**  
**(Managing Director)**  
DIN: 08789604  

Place: Mumbai  
Date: 01/08/2025



**ITC Limited**


**Extract of Unaudited Standalone and Consolidated Financial Results for the Quarter ended 30th June, 2025**  
₹ in Crores)  

Sl. No.	Particulars	Standalone			Consolidated		
		3 Months ended 30.06.2025	Twelve Months ended 31.03.2025	Corresponding 3 Months ended 30.06.2024	3 Months ended 30.06.2025	Twelve Months ended 31.03.2025	Corresponding 3 Months ended 30.06.2024
1	Total Income from continuing operations	21721.06	77690.38	18291.56	23811.56	84142.47	20032.78
2	Net Profit / (Loss) for the period from continuing operations (before tax and Exceptional items)	6545.11	26000.86	6421.61	7128.01	26926.94	6818.57
3	Net Profit / (Loss) for the period from continuing operations before tax (after Exceptional items)	6545.11	26528.82	6421.61	7128.01	26926.94	6818.57
4	Net Profit / (Loss) for the period from continuing operations after tax	4912.36	20091.85	4819.93	5343.41	20036.47	5092.32
5	Net Profit / (Loss) for the period from discontinued operations (before tax and Exceptional items)	-	572.52	133.13	-	525.84	122.52
6	Exceptional items of discontinued operations	-	15163.06	(3.04)	-	15128.81	(3.04)
7	Net Profit / (Loss) from discontinued operations for the period after tax	-	15103.76	97.52	-	15016.01	84.67
8	Profit for the period [4+7]	4912.36	35195.61	4917.45	5343.41	35052.48	5176.99
9	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	5101.19	34266.23	4769.90	5557.49	34427.62	4943.05
10	Equity Share Capital	1251.75	1251.41	1248.47	1251.75	1251.41	1248.47
11	Reserves (excluding Revaluation Reserve)	-	66648.73	-	-	68778.64	-
12	Earnings Per Share (of ₹ 1/- each) (not annualised):						
	1. Basic (for continuing operations) (₹):	3.93	16.07	3.86	4.19	15.78	4.01
	2. Diluted (for continuing operations) (₹):	3.92	16.05	3.85	4.18	15.76	4.00
	3. Basic (for discontinued operations) (₹):	-	12.08	0.08	-	12.01	0.07
	4. Diluted (for discontinued operations) (₹):	-	12.06	0.08	-	11.99	0.07
	5. Basic (for continuing and discontinued operations) (₹):	3.93	28.15	3.94	4.19	27.79	4.08
	6. Diluted (for continuing and discontinued operations) (₹):	3.92	28.11	3.93	4.18	27.75	4.07

Notes:  
a) The above is an extract of the detailed format of the Statements of Unaudited Standalone and Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The unaudited Financial Results and Segment Results were reviewed by the Audit Committee, and approved by the Board of Directors of the Company at its meeting held on 1st August, 2025. The complete Statements of Unaudited Standalone and Consolidated Financial Results are available on the Company's website at <https://www.itcportal.com/about-itc/shareholder-value/key-financials/quarterly-results.aspx> and on the websites of the National Stock Exchange of India Limited ([www.nseindia.com](http://www.nseindia.com)), BSE Limited ([www.bseindia.com](http://www.bseindia.com)) and The Calcutta Stock Exchange Limited ([www.cse-india.com](http://www.cse-india.com)). The same can also be accessed by scanning the QR Code provided below.  
b) The Limited Review for the Standalone and Consolidated Financial Results, as required under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, has been completed by the statutory auditors of the Company, who have issued an unmodified report on the same which has been forwarded to the Stock Exchanges.  


Registered Office:  
Virginia House, 37 J.L. Nehru Road,  
Kolkata 700 071, India  
Dated: 1st August, 2025  
Place: Kolkata, India  


For and on behalf of the Board  
Sd/-  
**Director & Chief Financial Officer**  
(DIN: 01804345)  
Sd/-  
**Chairman & Managing Director**  
(DIN: 00280529)



The Financial Results along with the Limited Review Report have been posted on the Company's website at [www.itcportal.com](http://www.itcportal.com) and can be accessed by scanning the QR Code.  

Website: [www.itcportal.com](http://www.itcportal.com)  
E-mail: [endingvalue@itc.in](mailto:endingvalue@itc.in)  
Phone: +91-33-2288 9371  
Fax: +91-33-2288 0655  
CIN: L16005WB1910PLC001985




**WORLD LEADER IN AIR COOLING**  
Thinking of Tomorrow  
  
**SYMPHONY LIMITED**  
(₹ in Crores)  
**Extract of Unaudited Consolidated Financial Results for the Quarter Ended on June 30, 2025**  

Particulars	Quarter Ended	Quarter Ended	Year Ended	
	30-Jun-25	30-Jun-24	31-Mar-25	
	(Unaudited)	(Unaudited)	(Audited)	
<b>Continuing operations</b>				
Revenue from operations	251	393	1,256	
EBITDA (Excluding Other Income, Exceptional Items and Foreign Exchange & MTM Loss)	26	88	97	
Exceptional items	(5)	-	46	
<b>Net Profit for the period/year from Continuing operations</b>	<b>39</b>	<b>73</b>	<b>211</b>	
<b>Net Profit for the period/year from Discontinued Operations</b>	<b>3</b>	<b>15</b>	<b>2</b>	
<b>Net Profit for the period/year</b>	<b>42</b>	<b>88</b>	<b>213</b>	
<b>Earnings Per Share from Continuing and discontinued operations (of ₹ 2/- each) *</b>				
	Basic & Diluted (₹)	6.08	12.76	30.89

\* EPS is not annualised for the quarter ended June 30, 2025 and June 30, 2024.  
NOTES:  
1. Key numbers of Standalone Results are as under:  


Particulars	Quarter Ended	Quarter Ended	Year Ended
	30-Jun-25	30-Jun-24	31-Mar-25
	(Unaudited)	(Unaudited)	(Audited)
Revenue from operations	229	373	1,182
EBITDA (Excluding Other Income, Exceptional Items and Foreign Exchange & MTM Loss)	24	82	287
Exceptional items	(5)	-	87
<b>Net Profit after Tax for the period/year</b>	<b>37</b>	<b>69</b>	<b>176</b>


2. The Board of Directors in their meeting held on August 01, 2025 declared 1st interim dividend of ₹ 1/- (50%) per equity share of ₹ 2/- each amounting to ₹ 6.87 crores.  
3. The above is an extract of detailed Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015. The full format of the Consolidated and Standalone Financial Results for the quarter ended June 30, 2025 are available on the Stock Exchange websites [www.nseindia.com](http://www.nseindia.com), [www.bseindia.com](http://www.bseindia.com) and on Company's website [www.symphonylimited.com](http://www.symphonylimited.com).  




By Order Of The Board  
For **Symphony Limited**  
**Achal Bakari**  
**Chairman & Managing Director**  
DIN-00397573  


Place : Ahmedabad  
Date : August 01, 2025



**27°C World**  
World Leader in Air Cooling Solutions for Residential, Commercial, and Industrial Spaces. Trusted in Over 60 Countries Worldwide. Now Offering Advanced Tower Fans and Geysers.  
Registered Office: Symphony House, FP-12 TP-50, Bodakdev, Off SG Highway, Ahmedabad 380059, Gujarat, India.  
CIN: L32010GJ1988PLC010531 | Web: [www.symphonylimited.com](http://www.symphonylimited.com) | Email: [corporate@symphonylimited.com](mailto:corporate@symphonylimited.com) | Phone: +91-79-66211111 | Fax: +91-79-66211139  
Our Global Brands: 



**Enduring Value**



**FMCG | Paperboards & Packaging | Agri Business | Information Technology**  
9593.2025



